

# Num

## Chapter 2

Gujarati Interlinear

Reference: American Standard Version

1 וַיְדַבֵּר יְהוָה אֶל-מֹשֶׁה וְאֶל-אַהֲרֹן לֵאמֹר:  
અને-બોલ્યા યહોવા અને-મૂસાને — અહોરને અહોને:  
[H0559](#) [H0175](#) [H0413](#) [H4872](#) [H0413](#) [H3068](#) [H1696](#)

And Jehovah spake unto Moses and unto Aaron, saying,

2 אִישׁ עַל-דִּגְלוֹ בְּאֵתוֹת לְבָיִת אָבֹתָם יַחְנֹוּ בְּנֵי יִשְׂרָאֵל מִמֶּנֶּד  
દરેક-માણસ પોતાના ધ્વજ-પાસે નિશાનીઓ-સાથે લેબિત પિતાઓના ઇવાણી-કરશે ઇવાણી-કરશે ઇવાણી-કરશે ઇવાણી-કરશે  
[H5048](#) [H3478](#) [H2583](#) [H0001](#) [H0226](#) [H1714](#) [H0376](#)  
: יַחְנֹוּ מוֹעֵד לְאֹהֲלֵי-קֹדֶשׁ  
ઇવાણી-કરશે મુલાકાત મુલાકાતના-mંsપ આસપાસ  
[H2583](#) [H4150](#) [H0168](#) [H5439](#)

The children of Israel shall encamp every man by his own standard, with the ensigns of their fathers' houses: over against the tent of meeting shall they encamp round about.

3 וְהַחֲנִימִים וְקִדְמָהּ מִזֶּרְחָהּ וְהַדָּגֵל דְּלִמְנַחְתָּהּ מִן-יְהוּדָה לְצַבְאוֹתָם וְנָשִׂיא  
અને-ઇવાણી-કરનારા પૂર્વ-તરફ ઊગતા-સૂર્ય-તરફ ધ્વજ ઇવાણીનો ઇવાણીનો ઇવાણીનો ઇવાણીનો  
[H3063](#) [H4264](#) [H1714](#) [H4217](#)  
: עַמִּינָדָב בֶּן-נַחֲשׁוֹן יְהוּדָה לְבָנֵי  
અમ્મીનાદાબ ના-દીકરો નાહશીન યહુદાના પુત્રોના  
[H5992](#) [H5177](#) [H3063](#)

And those that encamp on the east side toward the sunrising shall be they of the standard of the camp of Judah, according to their hosts: and the prince of the children of Judah shall be Nahshon the son of Amminadab.

4 וּצְבָאוֹ וּפְקֻדֵיהֶם אַרְבָּעָה וְשִׁבְעִים אֶלֶף וּשְׁשָׁנָה וְשָׁלֹשׁ מֵאוֹת:  
અને-તેનું-સૈન્ય અને-ગણાયેલા અને-ચાર અને-સિતેર અને-છ અને-છ  
[H3967](#) [H8337](#) [H0505](#) [H7657](#) [H0702](#)

And his host, and those that were numbered of them, were threescore and fourteen thousand and six hundred.

5 בֶּן-נַחֲמָדָב יִשְׁשַׁכָּר לְבָנֵי יִשְׁשַׁכָּר וְנָשִׂיא וְנָתַנְאֵל בֶּן-יִשְׁשַׁכָּר  
ના-દીકરો નાહમદાબ ઇસ્સાખારનું ઇસ્સાખારનું ઇસ્સાખારનું ઇસ્સાખારનું ઇસ્સાખારના પુત્રોના અને-અધિપતિ અને-અધિપતિ અને-અધિપતિ અને-અધિપતિ  
[H5417](#) [H3485](#) [H3485](#) [H4294](#) [H2583](#)  
: צוּעַר  
સુઆર  
[H6686](#)

And those that encamp next unto him shall be the tribe of Issachar: and the prince of the children of Issachar shall be Nethanel the son of Zuar.

6 וּצְבָאוֹ וּפְקֻדֵיהֶם אַרְבָּעָה וְחִמְשִׁים וְשָׁלֹשׁ מֵאוֹת:  
અને-તેનું-સૈન્ય અને-ગણાયેલા અને-ચાર અને-પચાસ અને-છ અને-છ  
[H3967](#) [H0702](#) [H0505](#) [H2572](#) [H0702](#)

And his host, and those that were numbered thereof, were fifty and four thousand and four hundred.

7 מֹשֶׁה זְבוּלוּן וְנָשִׂיא לְבָנֵי זְבוּלוּן אֶלְיָאֵב בֶּן-חֶלֶץ  
મૂસાને-અધિપતિ અબુલોનનું અબુલોનનું અબુલોનનું અબુલોનનું અબુલોનના પુત્રોના અને-અધિપતિ અલીઆબ ના-દીકરો હેલોન  
[H2497](#) [H0446](#) [H2074](#) [H2074](#) [H4294](#)

And the tribe of Zebulun: and the prince of the children of Zebulun shall be Eliab the son of Helon.

וּזְבֻלֹן	וּפְקֻדָּיו	שָׁבְעָה	וּחֲמִשִּׁים	אֶלְיָב	וְאֶרְבַּע	מֵאוֹת:	8
અને-તેનું-સૈન્ય	અને-ગણાયેલા	સાત	ને-પચાસ	હજાર	અને-ચાર	સો	
<a href="#">H3967</a>	<a href="#">H0702</a>	<a href="#">H0505</a>	<a href="#">H2572</a>	<a href="#">H7651</a>			

And his host, and those that were numbered thereof, were fifty and seven thousand and four hundred.

כָּל-	הַפְּקֻדָּים	לְמַחֲנֵה	יְהוּדָה	מֵאוֹת	אֶלְיָב	וּשְׁמַנִּים	אֶלְיָב	וְשֵׁשֶׁת-	אֲלָפִים	וְאַרְבַּע-	9
સર્વ	ગણાયેલા	છાવણીના	ચહુદાની	એક-લાખ	હજાર	ને-અંશી	હજાર	અને-છ	હજાર	અને-ચાર	
<a href="#">H3605</a>	<a href="#">H4264</a>	<a href="#">H3063</a>	<a href="#">H3967</a>	<a href="#">H5265</a>	<a href="#">H0505</a>	<a href="#">H8084</a>	<a href="#">H0505</a>	<a href="#">H8337</a>	<a href="#">H0505</a>	<a href="#">H0702</a>	
מֵאוֹת	לְצַבְאוֹתָם	רֵאשֵׁנָה	יִטְעוּ:	ס							
સો	તેઓની-ટુકડીઓ-પ્રમાણે	પહેલાં	કૂચ-કરશે	(પંડ)							
<a href="#">H3967</a>	<a href="#">H7223</a>										

All that were numbered of the camp of Judah were a hundred thousand and fourscore thousand and six thousand and four hundred, according to their hosts. They shall set forth first.

הַגִּבּוֹל	מַחֲנֵה	רְאוּבֵן	תִּימְנָה	לְצַבְאוֹתָם	וְנָשִׂיא	לְבִנֵי	רְאוּבֵן	אֶלְיָזָר	10
ધવજ	છાવણીનો	રબેનનો	દક્ષિણ-તરફ	તેઓની-ટુકડીઓ-પ્રમાણે	અને-અધિપતિ	પુત્રોના	રબેનના	અલીસૂર	
<a href="#">H1714</a>	<a href="#">H4264</a>	<a href="#">H7205</a>	<a href="#">H8486</a>				<a href="#">H7205</a>	<a href="#">H0468</a>	
בֶּן-	שְׁדֵיאוּר								
ના-દીકરો	શદેયૂર								
	<a href="#">H7707</a>								

On the south side shall be the standard of the camp of Reuben according to their hosts: and the prince of the children of Reuben shall be Elizur the son of Shedeur.

וּזְבֻלֹן	וּפְקֻדָּיו	שָׁשָׁה	וְאַרְבָּעִים	אֶלְיָב	וּחֲמִשָּׁה	מֵאוֹת:	11
અને-તેનું-સૈન્ય	અને-ગણાયેલા	છ	ને-ચાળીસ	હજાર	અને-પાંચ	સો	
<a href="#">H3967</a>	<a href="#">H0705</a>	<a href="#">H8337</a>	<a href="#">H0505</a>	<a href="#">H2568</a>	<a href="#">H0505</a>	<a href="#">H3967</a>	

And his host, and those that were numbered thereof, were forty and six thousand and five hundred.

צִוְרִי-שָׁדָי:	וְהַחֲנֹם	עֲלָיו	מִטָּה	שְׁמַעוֹן	וְנָשִׂיא	לְבִנֵי	שְׁמַעוֹן	שְׁלֹמִיאֵל	בֶּן-	12
સૂરીશાદાય	અને-છાવણી-કરનારા	તેની-પાસે	કુળ	શિમઓનનું	અને-અધિપતિ	પુત્રોના	શિમઓનના	શલુમીએલ	ના-દીકરો	
<a href="#">H6701</a>	<a href="#">H2583</a>	<a href="#">H4294</a>	<a href="#">H8095</a>				<a href="#">H8095</a>	<a href="#">H8017</a>		

And those that encamp next unto him shall be the tribe of Simeon: and the prince of the children of Simeon shall be Shelumiel the son of Zurishaddai.

וּזְבֻלֹן	וּפְקֻדָּיהֶם	תְּשָׁעָה	וּחֲמִשִּׁים	אֶלְיָב	וּשְׁלֹשׁ	מֵאוֹת:	13
અને-તેનું-સૈન્ય	અને-ગણાયેલા	નવ	ને-પચાસ	હજાર	અને-ત્રણ	સો	
<a href="#">H3967</a>	<a href="#">H8672</a>	<a href="#">H2572</a>	<a href="#">H0505</a>	<a href="#">H7969</a>	<a href="#">H0505</a>	<a href="#">H3967</a>	

And his host, and those that were numbered of them, were fifty and nine thousand and three hundred.

וּמִטָּה	גָּד	וְנָשִׂיא	לְבִנֵי	גָּד	אֶלְיָסָף	בֶּן-	רְעוּאֵל:	14
અને-કુળ	ગાદનું	અને-અધિપતિ	પુત્રોના	ગાદના	એલ્યાસાફ	ના-દીકરો	રેઆલ	
<a href="#">H1410</a>	<a href="#">H4294</a>		<a href="#">H1410</a>	<a href="#">H0460</a>	<a href="#">H7467</a>			

And the tribe of Gad: and the prince of the children of Gad shall be Eliasaph the son of Reuel.

וּזְבֻלֹן	וּפְקֻדָּיהֶם	חֲמִשָּׁה	וְאַרְבָּעִים	אֶלְיָב	וּשְׁשָׁה	מֵאוֹת	וּחֲמִשִּׁים:	15
અને-તેનું-સૈન્ય	અને-ગણાયેલા	પાંચ	ને-ચાળીસ	હજાર	અને-છ	સો	ને-પચાસ	
<a href="#">H3967</a>	<a href="#">H2568</a>	<a href="#">H0705</a>	<a href="#">H0505</a>	<a href="#">H8337</a>	<a href="#">H3967</a>	<a href="#">H2572</a>		

And his host, and those that were numbered of them, were forty and five thousand and six hundred and fifty.

מֵאוֹת	וְאַרְבַּע־	אֶלֶף	וַחֲמִשִּׁים	וְאַחַד	אֶלֶף	מֵאֹת	רְאוּבֵן	לְמַחֲנֵה	הַפְּקָדִים	כָּל־	16
સો	અને-ચાર	હજાર	ને-પચાસ	અને-એક	હજાર	એક-લાખ	રૂબેનની	છાવણીના	ગણાયેલા	સર્વ	
<a href="#">H3967</a>	<a href="#">H0702</a>	<a href="#">H0505</a>	<a href="#">H2572</a>	<a href="#">H0259</a>	<a href="#">H0505</a>	<a href="#">H3967</a>	<a href="#">H7205</a>	<a href="#">H4264</a>		<a href="#">H3605</a>	
וַחֲמִשִּׁים : יָסֻעוּ : וּשְׁנַיִם וְלִצְבָּאתָם (૫૬) કૂચ-કરશે અને-બીજા તેઓની-ટુકડીઓ-પ્રમાણે ને-પચાસ <a href="#">H5265</a> <a href="#">H8145</a> <a href="#">H2572</a>											

All that were numbered of the camp of Reuben were a hundred thousand and fifty and one thousand and four hundred and fifty, according to their hosts. And they shall set forth second.

בֶּן	יַחֲנוּ	כָּאֶשֶׁר	הַמַּחֲנֵה	בְּתוֹךְ	הַלְוִיִּם	מַחֲנֵה	מוֹעֵד	אֶהְלֵל־	וְנִסְעוּ	17
તેમ	છાવણી-કરે	જેમ	છાવણીઓની	વચ્ચે	લેવીઓની	છાવણી	મુલાકાત	મુલાકાતનો-મંડપ	અને-કૂચ-કરશે	
<a href="#">H2583</a>			<a href="#">H4264</a>	<a href="#">H8432</a>	<a href="#">H3881</a>	<a href="#">H4264</a>	<a href="#">H4150</a>	<a href="#">H0168</a>	<a href="#">H5265</a>	
וְיָסֻעוּ : אֵישׁ עַל־ יָדוֹ : לְדוֹלֵיהֶם : (૫૬) તેઓના-દવજો-પ્રમાણે જગ્યાએ પોતાની દરેક કૂચ-કરશે <a href="#">H1714</a> <a href="#">H3027</a> <a href="#">H0376</a> <a href="#">H5265</a>										

Then the tent of meeting shall set forward, with the camp of the Levites in the midst of the camps: as they encamp, so shall they set forward, every man in his place, by their standards.

אֶל־שֹׁמֵע	אֶפְרַיִם	לְבִנּוֹ	וְנָשִׂיא	יָמָה	לְצַבָּאתָם	אֶפְרַיִם	מַחֲנֵה	הַגִּבּוֹל	18	
અલીશામા	એફ્રાઈમના	પુત્રોના	અને-અધિપતિ	પશ્ચિમ-તરફ	તેઓની-ટુકડીઓ-પ્રમાણે	એફ્રાઈમનો	છાવણીનો	ધ્વજ		
<a href="#">H0476</a>	<a href="#">H0669</a>			<a href="#">H3220</a>		<a href="#">H0669</a>	<a href="#">H4264</a>	<a href="#">H1714</a>		
בֶּן־ עַמְמִיהוּד : અમ્મીહુદ ના-દીકરો <a href="#">H5989</a>										

On the west side shall be the standard of the camp of Ephraim according to their hosts: and the prince of the children of Ephraim shall be Elishama the son of Ammihud.

מֵאוֹת :	וַחֲמִשִּׁים	אֶלֶף	אַרְבָּעִים	וּפְקָדֵיהֶם	וּצְבָאוֹ	19
સો	અને-પાંચ	હજાર	ચાલીસ	અને-ગણાયેલા	અને-તેનું-સૈન્ય	
<a href="#">H3967</a>	<a href="#">H2568</a>	<a href="#">H0505</a>	<a href="#">H0705</a>			

And his host, and those that were numbered of them, were forty thousand and five hundred.

פְּדָהצֹר :	בֶּן־	גַּמְלִיאֵל	מְנַשֶּׁה	לְבִנּוֹ	וְנָשִׂיא	מְנַשֶּׁה	מַטְּהָ	וְעֹלָיו	20
પદાહસૂર	ના-દીકરો	ગામલીએલ	મનાશ્શાના	પુત્રોના	અને-અધિપતિ	મનાશ્શાનું	કુળ	અને-તેની-પાસે	
<a href="#">H6301</a>		<a href="#">H1583</a>	<a href="#">H4519</a>			<a href="#">H4519</a>	<a href="#">H4294</a>		

And next unto him shall be the tribe of Manasseh: and the prince of the children of Manasseh shall be Gamaliel the son of Pedahzur.

וּמְאֹתָיִם :	אֶלֶף	וּשְׁלֹשִׁים	שְׁנַיִם	וּפְקָדֵיהֶם	וּצְבָאוֹ	21
ને-બસો	હજાર	ને-ત્રીસ	બે	અને-ગણાયેલા	અને-તેનું-સૈન્ય	
<a href="#">H3967</a>	<a href="#">H0505</a>	<a href="#">H7970</a>	<a href="#">H8147</a>			

And his host, and those that were numbered of them, were thirty and two thousand and two hundred.

גִּדְעוֹנִי :	בֶּן־	אַבְדָּן	בְּנִימִן	לְבִנּוֹ	וְנָשִׂיא	בְּנִימִן	וּמַטְּהָ	22
ગિદ્દઓની	ના-દીકરો	અબીદાન	બિન્યામીનના	પુત્રોના	અને-અધિપતિ	બિન્યામીનનું	અને-કુળ	
<a href="#">H1441</a>		<a href="#">H0027</a>	<a href="#">H1144</a>			<a href="#">H1144</a>	<a href="#">H4294</a>	

And the tribe of Benjamin: and the prince of the children of Benjamin shall be Abidan the son of Gideoni.

מֵאוֹת :	וְאַרְבַּע	אֶלֶף	וּשְׁלֹשִׁים	מַטְּהָ	וּפְקָדֵיהֶם	וּצְבָאוֹ	23
સો	અને-ચાર	હજાર	ને-ત્રીસ	પાંચ	અને-ગણાયેલા	અને-તેનું-સૈન્ય	
<a href="#">H3967</a>	<a href="#">H0702</a>	<a href="#">H0505</a>	<a href="#">H7970</a>	<a href="#">H2568</a>			

And his host, and those that were numbered of them, were thirty and five thousand and four hundred.

לְצַבְאוֹתָם	וּמֵאָה	אַלְפִים	וּשְׁמֹנֶת־	אַלְף	מֵאֹת	אַפְרַיִם	לְמַחֲנֵה	הַפְּקָדִים	כָּל־	24
તેઓની-ટુકડીઓ-પ્રમાણે	ને-સો	હજાર	અને-આઠ	હજાર	એક-લાખ	એફ્રાઈમની	છાવણીના	ગણાયેલા	સર્વ	
	<a href="#">H3967</a>	<a href="#">H0505</a>	<a href="#">H8083</a>	<a href="#">H0505</a>	<a href="#">H3967</a>	<a href="#">H0669</a>	<a href="#">H4264</a>		<a href="#">H3605</a>	
								וְשֵׁלֹשִׁים	יָסֵעוּ :	ס
								અને-ત્રીજા	કૂચ-કરશે	(ખંડ)
									<a href="#">H5265</a>	<a href="#">H7992</a>

All that were numbered of the camp of Ephraim were a hundred thousand and eight thousand and a hundred, according to their hosts. And they shall set forth third.

בֶּן־	אַחִיעֶזֶר	דָּן	לְבִנּוֹ	וְנִשְׂאָא	לְצַבְאוֹתָם	צִפְנָה	הָן	מַחֲנֵה	הַגִּלְגָּל	25
ના-દીકરો	અહીએઝર	દાનના	પુત્રોના	અને-અધિપતિ	તેઓની-ટુકડીઓ-પ્રમાણે	ઉત્તર-તરફ	દાનની	છાવણીનો	ધ્વજ	
	<a href="#">H0295</a>	<a href="#">H1835</a>				<a href="#">H6828</a>	<a href="#">H1835</a>	<a href="#">H4264</a>	<a href="#">H1714</a>	
									עַמִּישַׁדָּי :	
									અમ્મીશાદાય	
									<a href="#">H5996</a>	

On the north side shall be the standard of the camp of Dan according to their hosts: and the prince of the children of Dan shall be Ahiezer the son of Ammishaddai.

מֵאֹת :	וְשֵׁבַע	אַלְף	וְשָׁשִׁים	שְׁנַיִם	וּפְקָדֵיהֶם	וּצְבָאוֹ	26
સો	અને-સાત	હજાર	ને-સાઠ	બે	અને-ગણાયેલા	અને-તેનું-સૈન્ય	
	<a href="#">H3967</a>	<a href="#">H7651</a>	<a href="#">H0505</a>	<a href="#">H8346</a>	<a href="#">H8147</a>		

And his host, and those that were numbered of them, were threescore and two thousand and seven hundred.

עֶכְרָן :	בֶּן־	פַּגְעִיאל	אַשֶׁר	לְבִנּוֹ	וְנִשְׂאָא	מִטָּה	עָלָיו	וְהַחֲנִים	27
ઓખ્રાન	ના-દીકરો	પાગીએલ	આશરના	પુત્રોના	અને-અધિપતિ	આશરનું	કુળ	અને-છાવણી-કરનારા	
<a href="#">H5918</a>		<a href="#">H6295</a>	<a href="#">H0836</a>			<a href="#">H0836</a>	<a href="#">H4294</a>	<a href="#">H2583</a>	

And those that encamp next unto him shall be the tribe of Asher: and the prince of the children of Asher shall be Pagiel the son of Ochran.

מֵאֹת :	וַחֲמִשָּׁ	אַלְף	וְאַרְבָּעִים	אַחַד	וּפְקָדֵיהֶם	וּצְבָאוֹ	28
સો	અને-પાંચ	હજાર	ને-ચાલીસ	એક	અને-ગણાયેલા	અને-તેનું-સૈન્ય	
	<a href="#">H3967</a>	<a href="#">H2568</a>	<a href="#">H0505</a>	<a href="#">H0705</a>	<a href="#">H0259</a>		

And his hosts, and those that were numbered of them, were forty and one thousand and five hundred.

עֵינָן :	בֶּן־	אַחִירָע	נַפְתָּלִי	לְבִנּוֹ	וְנִשְׂאָא	וּמִטָּה	29
એનાન	ના-દીકરો	અહીરા	નફતાલીના	પુત્રોના	અને-અધિપતિ	નફતાલીનું	અને-કુળ
<a href="#">H5881</a>		<a href="#">H0299</a>	<a href="#">H5321</a>			<a href="#">H5321</a>	<a href="#">H4294</a>

And the tribe of Naphtali: and the prince of the children of Naphtali shall be Ahira the son of Enan.

מֵאֹת :	וְאַרְבַּע	אַלְף	וַחֲמִשִּׁים	שְׁלֹשָׁה	וּפְקָדֵיהֶם	וּצְבָאוֹ	30
સો	અને-ચાર	હજાર	ને-પચાસ	ત્રણ	અને-ગણાયેલા	અને-તેનું-સૈન્ય	
	<a href="#">H3967</a>	<a href="#">H0702</a>	<a href="#">H0505</a>	<a href="#">H2572</a>	<a href="#">H7969</a>		

And his host, and those that were numbered of them, were fifty and three thousand and four hundred.

מֵאֹת	וְשָׁשִׁים	אַלְף	וַחֲמִשִּׁים	וְשֵׁבַע	אַלְף	מֵאֹת	דָּן	לְמַחֲנֵה	הַפְּקָדִים	כָּל־	31
સો	અને-છ	હજાર	ને-પચાસ	અને-સાત	હજાર	એક-લાખ	દાનની	છાવણીના	ગણાયેલા	સર્વ	
<a href="#">H3967</a>	<a href="#">H8337</a>	<a href="#">H0505</a>	<a href="#">H2572</a>	<a href="#">H7651</a>	<a href="#">H0505</a>	<a href="#">H3967</a>	<a href="#">H1835</a>	<a href="#">H4264</a>		<a href="#">H3605</a>	
							לְדָנְלִיהֶם :	יָסֵעוּ	לְאַחֲרָנָה	פ	
							(ખંડ)	કૂચ-કરશે	છેલ્લા		
						<a href="#">H1714</a>		<a href="#">H5265</a>	<a href="#">H0314</a>		

All that were numbered of the camp of Dan were a hundred thousand and fifty and seven thousand and six hundred. They shall set forth hindmost by their standards.

הַמַּחֲנֵה	פְּקוּדֵי	כָּל-	אַבְתָּם	לְבַיִת	יִשְׂרָאֵל	בְּנֵי-	פְּקוּדֵי	אֵלֶּה	32
છાવણીઓના	ગણાયેલા	સર્વ	પિતાઓના	પિતાના-ઘર	ઇઝરાયેલના	પુત્રોના	ગણાયેલા	આ	
<a href="#">H4264</a>		<a href="#">H3605</a>	<a href="#">H0001</a>		<a href="#">H3478</a>			<a href="#">H0428</a>	
וַחֲמִשָּׁים:	מֵאוֹת	וַחֲמִשָּׁ	אַלְפִים	וּשְׁלֹשָׁת	אֵלֶּה	מֵאוֹת	שֵׁשׁ-	לְצַבְאוֹתָם	
ને-પચાસ	સો	અને-પાંચ	હજાર	અને-ત્રણ	હજાર	સો	છ	તેઓની-ટુકડીઓ-પ્રમાણે	
<a href="#">H2572</a>	<a href="#">H3967</a>	<a href="#">H2568</a>	<a href="#">H0505</a>	<a href="#">H7969</a>	<a href="#">H0505</a>	<a href="#">H3967</a>	<a href="#">H8337</a>		

These are they that were numbered of the children of Israel by their fathers' houses: all that were numbered of the camps according to their hosts were six hundred thousand and three thousand and five hundred and fifty.

אֵת-	יְהוָה	צִוָּה	כְּאֲשֶׁר	יִשְׂרָאֵל	בְּנֵי	בְּתוֹךְ	הַתְּפֻקֹּדִים	לֹא	וַיִּקְלוּוָם	33
—	યહોવાએ	આજ્ઞા-આપી-હતી	જેમ	ઇઝરાયેલના	પુત્રોના	વચ્ચે	ગણાયા	નહિ	પણ-લેવીઓ	
<a href="#">H0853</a>	<a href="#">H3068</a>	<a href="#">H6680</a>		<a href="#">H3478</a>		<a href="#">H8432</a>		<a href="#">H3808</a>	<a href="#">H3881</a>	
									מִשֵּׁה:	
									મૂસાને	
									<a href="#">H4872</a>	

But the Levites were not numbered among the children of Israel; as Jehovah commanded Moses.

כֹּן-	מִשֵּׁה	אֵת-	יְהוָה	צִוָּה	אֲשֶׁר-	כָּכֹל	יִשְׂרָאֵל	בְּנֵי	וַיַּעֲשׂוּ	34
તેમ	મૂસાને	—	યહોવાએ	આજ્ઞા-આપી-હતી	જેમ	બધું-જેમ	ઇઝરાયેલના	પુત્રોએ	અને-કર્યું	
	<a href="#">H4872</a>	<a href="#">H0853</a>	<a href="#">H3068</a>	<a href="#">H6680</a>		<a href="#">H3605</a>	<a href="#">H3478</a>			
אַבְתָּיו:	בֵּית	עַל-	לְמִשְׁפְּחֹתָיו	אִישׁ	נִסְעוּ	וְכֹן	לְדִנְלֵיהֶם	הֵנּוּ		
પિતાઓના	પિતાના-ઘર	પોતાના	પોતાના-કુળો-પ્રમાણે	દરેક	ક્રૂચ-કર્યું	અને-તેમ	તેઓના-ધવજો-પ્રમાણે	છાવણી-કરી		
<a href="#">H0001</a>			<a href="#">H4940</a>	<a href="#">H0376</a>	<a href="#">H5265</a>		<a href="#">H1714</a>	<a href="#">H2583</a>		

Thus did the children of Israel; according to all that Jehovah commanded Moses, so they encamped by their standards, and so they set forward, every one by their families, according to their fathers' houses.